

પ્રમાણિક નિર્માણ કરનાર કામગીરી  
મીડી પુલ ને મરીન રેલીન 100 યુએ  
દેખીને લદામના જામિયના રામીય  
ભાઈ જિમીયના ભાઈ જાગર યુએસ  
પરોડી ને પદમના સે નિર્માણ કરનાર  
ભાગનાર કામ

  
Executive Engineer  
RWD Works Division  
Patanjali

Sch. XLV - Form No. 134

R-W-D PAKRIDAYA DIVISION

R.W.D. PATALI SUB-DIVISION

## Measurement Book

No.

1438

Name \_\_\_\_\_

Date of first entry \_\_\_\_\_

Date of last entry \_\_\_\_\_

2nd. on A/C Bill.

Sch. XLV-Form No.134

15

| Particulars                                | Details of actual measurement   |       |        |           | Contents of area     |
|--------------------------------------------|---------------------------------|-------|--------|-----------|----------------------|
|                                            | No.                             | L.    | B.     | D.        |                      |
| <u>Record Measurement</u>                  |                                 |       |        |           |                      |
| N/W:-                                      | const. of rd. & C.D. work from  |       |        |           |                      |
|                                            | matlia channapur to kauli-      |       |        |           |                      |
|                                            | Pokray Rd near school to        |       |        |           |                      |
|                                            | Kauli paka pokhara.             |       |        |           |                      |
|                                            | MMGSY NDB 'Amreshh'             |       |        |           |                      |
| Package NO -                               | MMGSY Amreshh NDB-              |       |        |           |                      |
|                                            | BRRP2 - 383 Pakaridaya.         |       |        |           |                      |
| Block -                                    | Patahi.                         |       |        |           |                      |
| Agency -                                   | M/S Trimurti construction,      |       |        |           |                      |
|                                            | Motikani, E. Champaran.         |       |        |           |                      |
| A/c No. -                                  | 31 SBI/2023-24.                 |       |        |           |                      |
| Date of start -                            | 23.2.2024.                      |       |        |           |                      |
|                                            |                                 |       |        |           |                      |
|                                            | Date of completion - 22.2.2025. |       |        |           |                      |
|                                            | A.M.R. - Rs. 15387848 = 60      |       |        |           |                      |
| (1) P.W. laying, spreading & compacting    |                                 |       |        |           |                      |
| Stone Agg. for W.B.M. Gr. - III - do - E.I |                                 |       |        |           |                      |
|                                            | 7x                              | 20.00 | x 3.75 | x 0.075 = | 39.37 m <sup>3</sup> |
|                                            | 10x                             | 30.00 | x 3.75 | x 0.075 = | 84.38 ,,             |
|                                            | 10x                             | 30.00 | x 3.75 | x 0.075 = | 84.38 ,,             |
|                                            | 10x                             | 30.00 | x 3.75 | x 0.075 = | 84.38 ,,             |
|                                            | 2x                              | 30.00 | x 3.75 | x 0.075 = | 16.88 ,,             |
|                                            | 9x                              | 30.00 | x 3.75 | x 0.075 = | 75.94 ,,             |
|                                            | 1x                              | 10.00 | x 3.75 | x 0.075 = | 2.81 ,,              |
|                                            |                                 |       |        | T-3       | 88.14 m <sup>3</sup> |
| 4.8.24.                                    |                                 |       |        |           |                      |
| J.E.                                       |                                 |       |        |           |                      |

Continuation



| Particulars                                                     | Details of actual measurement |    |    |    | Contents of area |
|-----------------------------------------------------------------|-------------------------------|----|----|----|------------------|
|                                                                 | No.                           | L. | B. | D. |                  |
| Road land - do - E.I.                                           |                               |    |    |    |                  |
| Qty. with T.M.B.P.N.D. - (9)                                    |                               |    |    |    |                  |
| 1.015 H.C. @ 76225 = 08/H.C.RS. 78079 =                         |                               |    |    |    |                  |
| (9/28) Elm. in conc. in foundry -                               |                               |    |    |    |                  |
| — do — do — E.I.                                                |                               |    |    |    |                  |
| Qty. with T.M.B.P.N.D. - (10)                                   |                               |    |    |    |                  |
| 225.528 m <sup>3</sup> @ 465-83/m <sup>3</sup> - RS. 91 526 =   |                               |    |    |    |                  |
| (6/30) P.V. P.C.C. Mix in foundry -                             |                               |    |    |    |                  |
| — do — do — E.I.                                                |                               |    |    |    |                  |
| Qty. with T.M.B.P.N.D. - (10)                                   |                               |    |    |    |                  |
| 30.434 m <sup>3</sup> @ 7946 = 12/m <sup>3</sup> - RS. 240615 = |                               |    |    |    |                  |
| (7/29) Sand filling in foundry -                                |                               |    |    |    |                  |
| — do — do — E.I.                                                |                               |    |    |    |                  |
| Qty. with T.M.B.P.N.D. - (10)                                   |                               |    |    |    |                  |
| 4.30 m <sup>3</sup> @ 578-66/m <sup>3</sup> - RS. 2488 =        |                               |    |    |    |                  |
| (8/31) P.V. P.C.C. Mix in foundry -                             |                               |    |    |    |                  |
| — do — do — E.I.                                                |                               |    |    |    |                  |
| Qty. with T.M.B.P.N.D. - (10)                                   |                               |    |    |    |                  |
| 94.42 m <sup>3</sup> @ 7906 = 12/m <sup>3</sup> - RS. 746492 =  |                               |    |    |    |                  |
| (9/32) P.V. P.C.C. Mix in foundry -                             |                               |    |    |    |                  |
| Struct. — do — E.I.                                             |                               |    |    |    |                  |
| Qty. with T.M.B.P.N.D. - (10)                                   |                               |    |    |    |                  |
| 45.372 m <sup>3</sup> @ 8500 = 64/m <sup>3</sup> - RS. 385691 = |                               |    |    |    |                  |
| (10/35) Silt & Raining HYS D.B.T.                               |                               |    |    |    |                  |
| — do — do — E.I.                                                |                               |    |    |    |                  |
| Qty. with T.M.B.P.N.D. - (10)                                   |                               |    |    |    |                  |
| 0.989 m <sup>3</sup> @ 75228 = 62/m <sup>3</sup> - RS. 74401 =  |                               |    |    |    |                  |

| Particulars                                                        | Details of actual measurement |    |    |    | Contents of area |
|--------------------------------------------------------------------|-------------------------------|----|----|----|------------------|
|                                                                    | No.                           | L. | B. | D. |                  |
| (11/33) P.V. P.C.C. Mg. in sub.                                    |                               |    |    |    |                  |
| 8 nos. - do - E/I.                                                 |                               |    |    |    |                  |
| Qty. vide T.M.B.P. No. - (11)                                      |                               |    |    |    |                  |
| 13.34 m <sup>3</sup> @ 8947 = 80/m <sup>3</sup> - Rs. 119364 = 00  |                               |    |    |    |                  |
| (12/36) P.V. P.C.C. Mg. in sub.                                    |                               |    |    |    |                  |
| 8 nos. - do - E/I.                                                 |                               |    |    |    |                  |
| Qty. vide T.M.B.P. No. - (11)                                      |                               |    |    |    |                  |
| 7.372 m <sup>3</sup> @ 10147 = 111/m <sup>3</sup> - Rs. 74804 = 00 |                               |    |    |    |                  |
| (13/36) P.V. - filling joint sanding                               |                               |    |    |    |                  |
| - do - do - E/I.                                                   |                               |    |    |    |                  |
| Qty. vide T.M.B.P. No. - (11)                                      |                               |    |    |    |                  |
| 24.00 m @ 5604/m - Rs. 134520                                      |                               |    |    |    |                  |
| (14/37) P.V. weep holes - do - E/I.                                |                               |    |    |    |                  |
| Qty. vide T.M.B.P. No. - (11)                                      |                               |    |    |    |                  |
| 48 nos. @ 14842/each - Rs. 7124 = 00                               |                               |    |    |    |                  |
| (15/38) P.V. drainage spout - do - E/I.                            |                               |    |    |    |                  |
| Qty. vide T.M.B.P. No. - (11)                                      |                               |    |    |    |                  |
| 4 nos. @ 66672/each - Rs. 2667200                                  |                               |    |    |    |                  |
| (16/41) B.N. in cm. (114) in                                       |                               |    |    |    |                  |
| found. - do - E/I.                                                 |                               |    |    |    |                  |
| Qty. vide T.M.B.P. No. - (11)                                      |                               |    |    |    |                  |
| 31.962 m <sup>3</sup> @ 6889 = 50/m <sup>3</sup> - Rs. 63572 = 00  |                               |    |    |    |                  |
| (17/22) P.V. P.C.C. Mg. in cap.                                    |                               |    |    |    |                  |
| - do - do - E/I.                                                   |                               |    |    |    |                  |
| Qty. vide T.M.B.P. No. - (11)                                      |                               |    |    |    |                  |
| 0.90 m <sup>3</sup> @ 8947 = 80/m <sup>3</sup> - Rs. 8053 = 00     |                               |    |    |    |                  |

| Particulars                                                       | Details of actual measurement |    |    |    | Contents of area |
|-------------------------------------------------------------------|-------------------------------|----|----|----|------------------|
|                                                                   | No.                           | L. | B. | D. |                  |
| (18/23) P.V. muck hooked in                                       |                               |    |    |    |                  |
| Parapet wall - do - E.I.                                          |                               |    |    |    |                  |
| Qty. muck T.M.B.P. No. - (92)                                     |                               |    |    |    |                  |
| 45 Nos. @ 148 = 42/each RS 1179 = 00                              |                               |    |    |    |                  |
| (19/24) P.V. Blasting in c.m. (1.4)                               |                               |    |    |    |                  |
| on B/W. - do - E.I.                                               |                               |    |    |    |                  |
| Qty. muck T.M.B.P. No. - (92)                                     |                               |    |    |    |                  |
| 71.25 m <sup>3</sup> @ 259 = 51/m <sup>3</sup> RS 18490 = 00      |                               |    |    |    |                  |
| (20/25) Exca. for road way cutting                                |                               |    |    |    |                  |
| in soil (Box cutting) - do - E.I.                                 |                               |    |    |    |                  |
| Qty. muck T.M.B.P. No. - (92)                                     |                               |    |    |    |                  |
| 14.70 m <sup>3</sup> @ 104 = 01/m <sup>3</sup> RS 1529 = 00       |                               |    |    |    |                  |
| (21/26) const. of embankment                                      |                               |    |    |    |                  |
| Sub-grade as per main                                             |                               |    |    |    |                  |
| shoulder with obtained material -                                 |                               |    |    |    |                  |
| - do - do - E.I.                                                  |                               |    |    |    |                  |
| Qty. muck T.M.B.P. No. - (92) - 3026.10 m <sup>3</sup>            |                               |    |    |    |                  |
| " " " - (96) - 1013.25 m <sup>3</sup>                             |                               |    |    |    |                  |
| 4039.35 m <sup>3</sup>                                            |                               |    |    |    |                  |
| @ 264 = 51/m <sup>3</sup> RS 1068448 = 00                         |                               |    |    |    |                  |
| (22/5) const. of embankment with                                  |                               |    |    |    |                  |
| obtained material - do - E.I.                                     |                               |    |    |    |                  |
| Qty. muck T.M.B.P. No. - (92)                                     |                               |    |    |    |                  |
| 1063.728 m <sup>3</sup> @ 196 = 04/m <sup>3</sup> RS 208533 = 00  |                               |    |    |    |                  |
| (23/6) const. of C.S.B. Gr.I by wall                              |                               |    |    |    |                  |
| gravel material - do - E.I.                                       |                               |    |    |    |                  |
| Qty. muck T.M.B.P. No. - (92)                                     |                               |    |    |    |                  |
| 1159.35 m <sup>3</sup> @ 3216 = 72/m <sup>3</sup> RS 3729304 = 00 |                               |    |    |    |                  |

